

**B.Ed. Semester - 1 (CBCS) Examination**  
**Feb/Mar. -2021 (NEW COURSE)**  
**ACCOUNT (SELF STUDY COURSE)**

Time: 1:30 Hours

Marks: 21

**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન.૧ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૫ માંથી ૦૩ ) (૦૩)
- (1) સ્થિર નાણામૂલ્ય એટલે શું ?
  - (2) પેટાનોધો એટલે શું ?
  - (3) NEFT અને RTGS નું પૂરું નામ જણાવો.
  - (4) કાચું સરવૈયું ગણિતની દ્રષ્ટિએ ક્યારે સાચું કહેવાય ?
  - (5) બેંક સિલકમેળ ક્યારે અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે?
- પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (૦૬ માંથી ૦૩ ) (૦૬)
- (1) પારિભાષિક શબ્દો સમજાવો – દેવું અને લેણું
  - (2) રોકડ અને ઉધાર વ્યવહાર વચ્ચેનો તફાવત આપો.
  - (3) ખતવણી એટલે શું ? સાદી આમનોંધના ઉદાહરણ દ્વારા ખતવણીની પ્રક્રિયા સમજાવો.
  - (4) પેટાનોધોના પ્રકારની યાદી આપો.
  - (5) નીચેના વ્યવહારો પરથી હિતેશના ચોપડે આમનોંધ લખો:
    1. રૂ. 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો.
    2. રોકડ ખરીદી રૂ.15,000 અને રોકડ વેચાણ રૂ.18,000
    3. ધરખર્ચ માટે રૂ.2000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા.
    4. રૂ.13,000 નું ચંત્ર રોકડેથી ખરીદ્યું તથા ચંત્ર ગોઠવણી ખર્ચના રૂ.600 રોકડા ચૂકવ્યા.
  - (6) ખાસ આમનોંધમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ દર્શાવો.
- પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. (૦૬ માંથી ૦૩ ) (૧૨)
- (1) હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ કોણ કોણ છે ?
  - (2) ઉધાર ચિકીનો નમૂનો આપો.
  - (3) નીચે આપેલા ખાતાની બાકી ઉધારબાકી હોય કે જમાબાકી તે દર્શાવો:
 

|                       |                      |
|-----------------------|----------------------|
| A. વેચાણ ખાતું        | E ઉપાડનું ખાતું      |
| B. વેચાણમાલ પરત ખાતું | F મકાનનું ખાતું      |
| C. ખરીદ ખાતું         | G મળેલ ભાડાનું ખાતું |
| D. મૂડી ખાતું         | H દેવાદારનું ખાતું   |
  - (4) નીચેના વ્યવહારો પરથી દિવ્યાબહેન ભટ્ટનો ત્રણ ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો.  
 જૂન 2020
    - (1) શરૂઆતની રોકડ સિલક રૂ. 10,000 , બેંક સિલક રૂ.16,000
    - (2) રૂ.3,000 નો માલ ચિરાગને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો.
    - (3) રૂ. 5,000 બેંકમાં ભર્યા.
    - (4) દિનેશ પાસેથી રૂ.5000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો.અડધી રકમ ચેકથી અને બાકીના નાણા રોકડા ચૂકવ્યા.
  - (5) રોકડમેળ મુજબ બેંકસિલક અને પાસબુક મુજબ બેંકસિલક વચ્ચે તફાવતના કોઈપણ ચાર કારણો જણાવો.
  - (6) “ખાતાવહી એ નામાનો મુખ્ય ચોપડો છે” – વિગતવાર સમજાવો.

**ENGLISH VERSION**

- Q.1 Answer any Three of the following questions. (03 Out of 05 ) (03)
- (1) What is stable value of money ?
  - (2) What is meant by Subsidiary books ?
  - (3) Explain the full form of NEFT and RTGS.
  - (4) When is a trial balance called 'mathematically correct' ?
  - (5) By whom and when the bank reconciliation statement is prepared ?
- Q.2 Answer any Three of the following questions in short.(03 Out of 06) (06)
- (1) Explain the terms : Payable and Receivable
  - (2) Distinguish between cash and credit transaction.
  - (3) What is Posting ? Explain the process of posting with the help of simple journal entry.
  - (4) Give the details of types of Subsidiary Books.
  - (5) From the following transactions, write journal in the books of Hitesh :
    1. Introduced Rs. 20,000 cash and commenced business.
    2. Cash Purchase Rs.15,000 and Cash Sales Rs. 18,000
    3. Rs. 2,000 withdrawn from bank for personal use.
    4. A machine purchased by cash Rs..13,000 and paid for machine installation Rs.600 in cash.
  - (6) Explain the classification of the transactions recorded in the Journal Proper.
- Q.3 Answer any Three of the following questions in brief. (03 Out of 06) (12)
- (1) Who are the users of accounting information ?
  - (2) Give the specimen of Debit Note.
  - (3) State whether the balance of the following accounts will have a debit balance or credit balance :

|                         |                         |
|-------------------------|-------------------------|
| A. Sales Account        | E Drawing Account       |
| B. Sales Return Account | F Building Account      |
| C. Purchase Account     | G Rent Received Account |
| D. Capital Account      | H Debtor's Account      |
  - (4) From the following transactions, prepare three columnar cash book of Divya Bhatt :  
June- 2020
    - (1) Cash Balance Rs. 10,000 , Bank Balance Rs.16,000
    - (2) Goods of Rs.3,000 sold to Chirag in cash at 10% cash discount.
    - (3) Rs. 5,000 deposited in the bank.
    - (4) Goods of Rs.5,000 purchased from Dinesh at 10% cash discount. Half of the amount is paid by cheque and remaining amount is paid in cash.
  - (5) State four reasons for different between balance as per cashbook and passbook.
  - (6) "Ledger is a Principal book of Account " – Explain in detail.

\*\*\*\*\*